



Tatva Chintan Pharma Chem Limited
(Formerly known as Tatva Chintan Pharma Chem Private Limited)
(CIN:U24232GJ1996PLC029894)



Date:-8 September 2021

Ref No:-TCPCL/SEC/2021-22/00015

To,

<p>The General Manager, Corporate relationship department, BSE Limited</p> <p>Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Fort, Mumbai-400 001</p> <p>Scrip Code: 543321 Through: BSE Corporate Compliance & Listing Centre.</p>	<p>The Manager, Listing department, National Stock Exchange of India Limited</p> <p>Exchange Plaza, C-1, Block-G. Bandra-Kurla, Complex Bandra(E), Mumbai-400 051</p> <p>Scrip Symbol: TATVA Through: NEAPS</p>
--	---

Dear Sir/Madam,

Sub:-Intimation about the date of closure of Register of members & Share Transfer Books and cut-off date for the purpose of 25th Annual General Meeting of the Company.

Pursuant to provisions of Section 91 of the Companies Act, 2013 read with rules framed thereunder and pursuant to Regulation 42 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015, amended we would like to inform you that the Register of Members and Share Transfer Books of the Company shall remain closed as per the detail mentioned below and that cut-off date for 25th Annual General Meeting of the Company are as under.

Security Code/ Symbol	Type of Security	Book closure (Both days inclusive)		Cut- off date	Record Date	Purpose
		From	To			
BSE-543321 NSE-TATVA	Equity	15/09/2021	29/09/2021	22/09/2021	N.A	25 th Annual General Meeting of the Company and identification members for E-voting

You are requested to take note of the same.

Thanking You



Tatva Chintan Pharma Chem Limited
(Formerly known as Tatva Chintan Pharma Chem Private Limited)
(CIN:U24232GJ1996PLC029894)



For, Tatva Chintan Pharma Chem Limited

Apurva

APURVA DUBEY
COMPANY SECRETARY AND COMPLIANCE OFFICER
(MEMBERSHIP NO:-A41130)

Factory and Registered Office: Plot No. 502/17, G.I.D.C. Estate, Ankleshwar - 393 002, District: Bharuch, Gujarat, India.

SEZ Unit: Plot No. Z/103/F/1 and Plot No. Z/103/F/2, SEZ Area Part-2, Dahej - 392 130, District: Bharuch, Gujarat, India.

DSIR Approved R & D Centre: Plot No. 353, G.I.D.C., Makarpura, Vadodara - 390 010, Gujarat, India.

Telephone No: +91 75748 48533 / 34 **Fax:** +91 265 263 8533

E-mail: chintan@tatvachintan.com **Website:** www.tatvachintan.com

HIND SECURITIES & CREDITS LIMITED
 Registered & Corporate Office-D-16, Ground Floor, Udyog Nagar, Nangloi, Delhi - 110041
 CIN: L74899DL1993PLC029894; Phone No-91-9899425575;
 e-mail address: supersecurities1993@gmail.com; Website: www.supersecurities.in

INTIMATION REGARDING COMPLETION OF DISPATCH OF NOTICE OF 28th ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE AND E-VOTING

Notice is hereby given that the 28th Annual General Meeting ("AGM") of the Members of Hind Securities & Credits Limited will be held on Thursday, September 30, 2021 at 11:00 a.m. through Video Conferencing ("VC") or Other Audio Visual Means ("OAVM") to transact the ordinary businesses as stated in the Notice convening the AGM. As per the various Circular issued by MCA, the Notice of the AGM together with the Annual Report of the Company for the Financial Year 2020-21 has been sent to the Members of the Company by e-mail to their registered e-mail addresses. The Company has completed the mailing of Notice convening the AGM alongwith the aforesaid Annual Report on September 7, 2021.

The Members, who have not registered their e-mail addresses so far, are requested to register their e-mail addresses with their concerned Depository Participant (in respect of shares held in demat form) or with Link Intime India Private Limited, Registrar & Share Transfer Agent (RTA) of the Company (in respect of shares held in physical form).

Members are hereby informed that the notice of the 28th AGM and the Annual Report of the Company are also available on the Company's website (www.supersecurities.in). Notice of AGM is also available on the e-voting website of National Securities Depository Limited (NSDL) at www.evoting.nsdl.com.

Members are also informed that pursuant to Section 108 of the Companies Act, 2013 ("the Act") read with the relevant rules made thereunder, as amended from time to time, the Company is providing remote e-voting (prior to the AGM) and e-voting during AGM to its members to cast their votes electronically on the resolutions to be passed at the 28th AGM. The Members are further informed that the cut-off date for the purpose of ascertaining the members eligible for e-voting facility has been fixed as Thursday, September 23, 2021. A person, whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avail the facility of remote e-voting as well as e-voting during AGM.

The Members are requested to note that remote e-voting process shall commence on Monday, September 27, 2021 at 9:00 a.m. and will remain open upto Wednesday, September 29, 2021 at 11:00 p.m. Thereafter, the remote e-voting module shall be disabled by NSDL. Once the vote on a resolution is cast by a Member, he/she shall not be allowed to change it subsequently. The Members who have not cast their vote through remote e-voting can exercise their voting rights electronically during AGM. The Members who have cast their votes by remote e-voting prior to the AGM may also attend the AGM, but shall not be entitled to cast their vote again during AGM. The Company has appointed Mr. Chetan Gupta (Membership No. FCS-6496 & CP No. 7077), Practicing Company Secretary, as the scrutiner to scrutinize the e-voting process in a fair and transparent manner.

The detailed procedure/ instructions for remote e-voting, attending AGM and e-voting during AGM are contained in the Notice of 28th AGM.

The remote e-voting facility is available to the Members to cast their votes at the e-voting website of NSDL - www.evoting.nsdl.com or the Member may refer Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders, available at the download section of www.evoting.nsdl.com or call on toll free no.: 1800 1020 990 and 1800 22 44 30 or send a request at evoting@nsdl.co.in.

Any query or grievance in relation to e-voting may be addressed to Ms. Priyanka Sethi, Company Secretary, e-mail address: supersecurities1993@gmail.com, Address: D-16, Ground Floor, Udyog Nagar, Nangloi, Delhi - 110041, Contact No. 91-9899425575.

Any person who becomes a Member after sending the Notice and Annual Report through e-mail but who holds shares as on cut-off date can attend the AGM through VC / OAVM. Such Member can exercise his voting right through remote e-voting or e-voting during AGM and send a request for a copy of the Annual Report and Notice convening the AGM through e-mail communication to RTA at delhinkintime.co.in with a copy marked to the Company at linkintime.com/his/her/itsrelevantparticulars i.e. DP ID & Client ID / Folio No. to obtain User Id and Password for e-voting. If shareholder is individual shareholder and hold shares in demat mode he/she can generate password as explain in e-voting instruction.

Since the 28th AGM will be held pursuant to the aforesaid Circulars through VC / OAVM, physical attendance of Members has been dispensed with. Accordingly, the facility for appointment of proxies by the Members will not be available.

Notice is also hereby given that pursuant to the provisions of Section 91 of the Act, the Register of Members and the Share Transfer Books of the Company will remain closed from Friday, September 24, 2021 to Thursday, September 30, 2021 (both days inclusive) for the purpose of 28th AGM.

By order of the Board of Directors
 For Hind Securities & Credits Limited
 Sd/-
 (Priyanka Sethi)
 Company Secretary
 Membership No.: A32756

Date : September 7, 2021
 Place : Delhi

ASSAM ENTRADE LIMITED
 Regd. off: 16 TARA CHAND DUTTA STREET, 2ND FLOOR, KOLKATA-700073
 CIN: L20219WB1985PLC096557; website: www.assamentrade.com
 Email: assamentrade1985@gmail.com; telephone no: 033-22343520

NOTICE TO MEMBERS OF 36th ANNUAL GENERAL MEETING THROUGH VIDEO CONFERRING (VC) / OTHER AUDIO VISUAL MEANS (OAVM), REMOTE E-VOTING INFORMATION AND BOOK CLOSURE

This is in continuation to our earlier communication dated 05/09/2021, whereby Members of Assam Entrade Limited ("the Company") were informed that in compliance with the provisions of the Companies Act, 2013 and Rules framed thereunder and the SEBI (LODR) Regulations, 2015 read with general circular Nos. 14/2020, 17/2020, 20/2020 and 02/2021 dated April 08, 2020, April 13, 2020, May 05, 2020 and January 13, 2021 respectively issued by the Ministry of Corporate Affairs and Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020 issued by the SEBI, it was decided to convene the 36th AGM of the Company on Thursday, 30th September, 2021 at 02:30 p.m. through Video Conferencing/Other Audio Visual Means ("OAVM") facility, without the physical presence of the Members at a common venue, to transact the business as set out in the Notice of 36th AGM.

The Notice of 36th AGM and Annual Report of the Company for the FY 2020-2021 along with login details for e-voting has been sent on 7th September, 2021 through email to all those members whose email id was registered with the Company or the Registrar and Share Transfer Agent or with their respective Depository Participant ("DP") in accordance with the above MCA circulars and SEBI Circulars, and the same are also available on Company's website (www.assamentrade.com), BSE website (www.bseindia.com) and on the website of NSDL (at www.evoting.nsdl.com).

In compliance with the provisions of Section 108, of Companies Act, 2013 and rules framed thereunder, Regulation 44 of SEBI (LODR) Regulations, 2015, Secretarial Standard-2 issued by ICSI and MCA Circulars, the Members are provided with the facility to cast their votes electronically through remote e-voting (prior to e voting) and e-voting (during the AGM) services provided by NSDL on all resolutions set forth in the Notice of 36th AGM.

The remote e-voting shall commence on 27th September, 2021 (at 09:00 a.m.) and ends on 29th September, 2021 (at 05:00 p.m.). During this period, members may cast their votes electronically. Thereafter, the remote e voting module shall be disabled by NSDL for voting.

The Members who will have cast their votes by remote e-voting prior to the AGM may also participate in the AGM through VC/OAVM facility but shall not be entitled to cast their votes again through e voting facility available during AGM.

Once the Members cast vote on a resolution, they shall not be allowed to change it subsequently. Detailed instructions of remote e voting, joining the AGM, and e-voting during AGM are provided in the Notice of 36th AGM.

CS Saket Sharma, Practicing Company Secretary (Mem no: 4229; COP: 2565), has been appointed as Scrutinizer by the Company to scrutinize the entire e voting process in a fair and transparent manner. The voting rights of the members shall be in proportion to the equity shares held by them in the paid up equity share capital of the Company as on 23rd September, 2021 ("cut off date"). A person, whose name is recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the Depositories as on the cut off date shall only be entitled to join the AGM, avail the remote e voting and e voting facility during the AGM. A person who ceases to be a Member as on cut off date should treat this Notice for information purpose only.

Any person, who acquires shares and becomes a Member of the Company after the date of electronic dispatch of the Notice of 36th AGM and holding shares as on the Cut off date, may obtain the Login ID and password by following the instructions as mentioned in the Notice of 36th AGM or sending a request to e.voting@nsdl.in. However, if he/she is already registered with NSDL for remote e voting, then he/she can use his/her existing User ID and password to cast their vote.

If you have not registered your email address with the Company/DP, you may please follow the below instructions for obtaining details for e voting:

Physical Holding	Please provide necessary details like Folio No., name of Shareholders, scanned copy of the share certificate (front and back), self attested scanned copy of PAN card, self-attested scanned copy of Aadhar Card or any other document as proof of address by email to Company/RTA email id.
Demat Holding	Please provide DEMAT account details (CDSL: 16 digit beneficiary ID) or (NSDL: 16 Digit DPID -CLID). Name, client master or copy of Consolidated Account statement, self-attested scanned copy of Aadhar Card or any other document as proof of address to Company/RTA email id.

Further, pursuant to the provisions of Section 91 of Companies Act, 2013 and Rules framed thereunder and Regulation 42 of SEBI (LODR) Regulations, 2015, The Register of Members and Share Transfer Books of the Company will remain closed from Friday 24th September, 2021 till Thursday, 30th September, 2021 (both days inclusive) for the purpose of 36th AGM.

The result of e voting shall be declared within 48 hours from the conclusion of AGM i.e on or before 02nd October, 2021 and results so declared along with the consolidated Scrutinizer's Report will be placed on the Company's website (www.assamentrade.com) and NSDL website (www.evoting.nsdl.com).

In case of any queries or issues, you may refer the frequently asked questions and e voting manual available at https://www.nsdl.co.in/faqs/faq.php or write an email at evoting@nsdl.co.in.

For Assam Entrade Limited
 Sd/- (Shalini Aganwal)
 (Company Secretary/Compliance Officer)

Place : Kanpur
 Date : 08.09.2021

RACL Geartech Limited
 CIN : L34300DL1983PLC016136
 Regd. Office: 15th Floor, Eros Corporate Tower, Nehru Place, New Delhi - 110019
 Phones: +91-11-66155129, +91-120-4588500
 Fax No.: +91-120-4588513 | E-Mail: investor@rACLgeartech.com
 Website: www.rACLgeartech.com

NOTICE FOR THE LOSS OF SHARE CERTIFICATES

NOTICE is hereby given that following share certificate(s) issued by the Company are stated to be lost/ misplaced and the registered holder thereof have applied to the Company for issue of duplicate share certificates:

Folio No.	Name of the Shareholder	Share Certificate(s) No.	Distinctive Numbers		No. of Shares
			From	To	
0013143	Bipin R Mehta	22180-81	4817008	4817207	200

The public is hereby warned against purchasing or dealing in any way with the above share certificates. Any person(s) who has/ have any claim(s) with the Company in respect of the said share certificates should lodge such claim at its Registered Office at the address given above within 15 days of the publication of this Notice, after which no claim will be entertained and the Company will proceed to issue Duplicate Share Certificates.

For RACL Geartech Limited
 Sd/-
 Shagun Bajpai
 Company Secretary & Compliance Officer

Place: Noida
 Date: 7th September, 2021

ASHOKA MARKETING LIMITED
 (CIN : U74899DL1948PLC005771)
 Regd. Office: First Floor, Express Building, 9-10, Bahadur Shah Zafar Marg, New Delhi-110002
 Email: ashokamarketing1@gmail.com, Phone No.: 011-43540801

PUBLIC NOTICE FOR PROPOSED CHANGE OF MANAGEMENT

In compliance with the Para 5 of Notification No. DNES. (PD) 029/CGM (CDS)-2015 issued by Reserve Bank of India on July 09, 2015, Notice is hereby given that M/s. Ashoka Marketing Limited, a company incorporated under the provisions of the Companies Act, 1913 and having its Registered Office at First Floor, Express Building, 9-10, Bahadur Shah Zafar Marg, New Delhi-110002 and registered with the Reserve Bank of India vide Certificate Number 14.01778 as a Non Deposit taking NBFC (hereinafter referred to as "the Company") hereby propose the change in the management of the Company by appointing Mr. Ramesh Sehgal as an Additional Director on the Board of the Company. The Company has already obtained the prior approval for change of Management from RBI, Delhi vide letter No. 272 /CMS-IV/05.01.21/2021-22 dated September 6, 2021. The proposed move is aimed to broad base the existing Board.

Any clarification / Objection in this regard may be addressed to Department of Non-Banking Supervision, Reserve Bank of India, 6, Sansad Marg, Delhi-110001 within 30 days from the date of publication of this notice stating therein the nature of interest and grounds of objection.

For Ashoka Marketing Limited
 Sd/-
 Sukanta Kumar Mohanty
 Chief Financial Officer

Dated: 07/09/2021
 Place: New Delhi

TATVA CHINTAN PHARMA CHEM LIMITED
 (CIN: U24232GJ1996PLC029894)
 Registered Office: Plot No. 502/17 GIDC Estate, Ankleshwar, Bharuch GJ 393002 IN. Phone: +91 7574848533/34, Fax: +91 265 263 8533
 Email: cs@tatvachintan.com, Website: www.tatvachintan.com

PUBLIC NOTICE REGARDING THE 25th ANNUAL GENERAL MEETING (AGM) TO BE HELD THROUGH VIDEO CONFERENCE ("VC")/ OTHER AUDIO VISUAL MEANS ("OAVM") AND E-VOTING INFORMATION

NOTICE is hereby given that the 25th Annual General Meeting ("AGM") of Tatva Chintan Pharma Chem Limited ("the Company") will be held on Wednesday, 29 September 2021 at 4:00 p.m. (IST) through Video Conference ("VC")/ Other Audio Visual Means ("OAVM") in compliance with all circulars issued by the Ministry of Corporate Affairs ("MCA") and issued by Securities and Exchange Board of India (hereinafter collectively referred to as circulars).

In terms of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules 2015 as amended and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015 as amended from time to time, the following information is available to members of the Company:

Members holding equity shares either in physical form or dematerialized form, as on the cut-off date 22 September 2021 may cast their vote electronically on the business as set forth in the notice of the 25th AGM through the electronic voting system of Link Intime India Private Limited https://instavote.linkintime.co.in (agency appointed for providing the Remote e-Voting facility)

All the members are hereby informed that:

- The business as set forth in the notice of the 25th AGM shall be transacted through remote e-voting and e-voting during the AGM;
- The remote e-voting shall commence on 26 September 2021 at 9:00 a.m. (IST);
- The remote e-voting shall close on 28 September, 2021 at 5:00 p.m. (IST);
- The cut-off date for determining the eligibility to vote by remote e-voting and/or e-voting during the AGM shall be 22 September 2021.
- Any person, who acquires equity shares of the Company and becomes a member of the Company after dispatch of the notice of the AGM may obtain the Login ID and password as per the Instructions given in the note no. 25 of the notice of AGM.
- Members may note that:
 - The remote e-voting shall be disabled beyond 5:00 p.m. (IST) on 28 September 2021 and once the vote on resolution is cast and confirmed by the member shall not be allowed to change it subsequently;
 - The facility for e-voting will also be made available during the AGM and those members present at the AGM through VC/OAVM facility, who have not cast their vote on resolution through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-voting system at the AGM. The detailed procedure for voting during the AGM is set out in the notice at note no. 25 of Instruction part of the notice.
- The Members who have cast their vote by remote e-voting prior to the AGM may also join the AGM through VC but shall not be entitled to cast their vote again;
- A person, whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date i.e. 22 September 2021 only shall be entitled to cast their vote either through remote e-voting or through e-voting at the AGM;
- Members may note that the said Notice and Annual Report are available on the Company's website www.tatvachintan.com, website of the Stock Exchanges i.e. BSE Limited ("BSE") and National Stock Exchange of India Limited ("NSE") at www.bseindia.com and www.nseindia.com respectively and on the website of Link Intime India Private Limited https://linkintime.co.in an agency appointed for conducting Remote e-voting during the AGM.
- All grievances connected with the facility for voting by electronic means may be addressed to Mr. Rajiv Ranjan (AVP), Link Intime or send an email to enotice@linkintime.co.in or mt@linkintime.co.in or call on Tel: 022-49186000.

Helpdesk for Individual Shareholders holding securities in demat mode:

In case shareholders/ members holding securities in demat mode have any technical issues related to login through Depository i.e. NSDL/ CDSL, they may contact the respective helpdesk given below:

Login Type	Helpdesk details
Individual Shareholders holding securities in demat mode with NSDL	Members facing any technical issue in login can contact NSDL helpdesk by sending a request at evoting@nsdl.co.in or call at toll free no.: 1800 1020 990 and 1800 22 44 30
Individual Shareholders holding securities in demat mode with CDSL	Members facing any technical issue in login can contact CDSL helpdesk by sending a request at helpdesk.evoting@cdslindia.com or contact at 022-23058738 or 22-23058542-43.

Helpdesk for Individual Shareholders holding securities in physical mode/ Institutional shareholders & e-voting service provider is LINK INTIME.

In case shareholders/ members holding securities in physical mode/ Institutional shareholders have any queries regarding e-voting, they may refer the Frequently Asked Questions ("FAQs") and InstaVote e-Voting manual available at https://instavote.linkintime.co.in, under Help section or send an email to enotices@linkintime.co.in or contact on: Tel: 022-4918 6000.

Notice is also hereby given that pursuant to the provisions of Section 91 (1) of the Companies Act, 2013 and Regulation 42 of SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015, the Register of Members and Share Transfer Books of the Company shall remain closed from 15 September 2021 to 29 September 2021 (Both days inclusive) for the purpose of 25th AGM.

By Order of Board
 For Tatva Chintan Pharma Chem Limited
 Sd/-
 Apurva Dubey
 Company Secretary and Compliance Officer

Date: 06.09.2021
 Place: Vadodra

ROYAL CUSHION VINYL PRODUCTS LIMITED
 CIN No: L24110MH1983PLC031395
 "Shlok" 60 - CD, Govt. Industrial Estate, Charkop, Kandivali (W), Mumbai - 400 067. Tel: +91 22 28603514, 16
 Website: www.rcvp.in; Email id: legalho83@gmail.com

NOTICE

Notice is hereby given that the 37th (Thirty Seventh) Annual General Meeting ("AGM") of Royal Cushion Vinyl Products Limited ("the Company") will be held through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") on Thursday 30th September, 2021 to transact the businesses as mentioned in the Notice convening the said meeting which is emailed to the members of the Company.

The Annual Report for the financial year 2020-21 of which notice of the 37th AGM is a part have been sent in electronic mode to members whose email-ids are registered with the Company or Depository Participant(s). The requirements of sending physical copy of the Notice of the AGM and Annual Report to the Members have been dispensed with vide MCA circular/s and SEBI circular. The Notice of the 37th Annual General Meeting which is a part of the Company's Annual Report is uploaded on the website of the Company at www.rcvp.in.

The Annual Report for the financial year 2020-21 of which the Notice of 37th AGM is a part is also available on the Company's website www.rcvp.in. Members who have not received the Annual Report may download it from the Company's website or may request for an electronic copy of the same by writing to the company at the above mention email id.

Notice is further given pursuant to Section 91 of the Companies Act, 2013 that the Register of Members and the Share Transfer Books of the Company will remain closed from 24th September, 2021 to 30th September, 2021, both days inclusive for the purpose of AGM.

Pursuant to the provision of Section 108 of the Companies Act, 2013 and Rule 20 of the Companies (Management and Administration) rules, 2014 as amended by the Companies (Management and Administration) Amendment Rules, 2015 and Regulation 44 of SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulation, 2015 the Company is pleased to provide its member with the facility to exercise their vote on the agenda items as stated in the notice of the Annual General Meeting by electronic means and the business may be transacted through the e-voting services provided by National Securities Depository Services Limited (NSDL). The details pursuant to the provisions of section 108 of the Companies Act, 2013 and the relevant Rules prescribed thereunder as follows:

- The business may be transacted through voting by electronic means.
- Date and time of commencement of remote e-voting: Monday 27th September, 2021 (9.00 a.m.)
- Date and time of end of remote e-voting: Wednesday 29th September, 2021 (5.00 p.m.)
- Cut off date: Thursday, 23rd September 2021.
- Any person, who acquires shares of the Company and has become member of the Company after dispatch of notice and holding shares as of the cut-off date i.e. 23rd September, 2021 may obtain the login ID and password by sending an email to evoting@nsdl.co.in or Company/ Registrars by mentioning his Folio No./DP ID and Client ID no. However, if any member is already registered with NSDL for remote e-voting, then he can use his existing User Id and Password for casting his vote. If he forgets his password, he can reset password by using "Forgot User Details/Password" or "Physical User/Reset Password" option available on www.evoting.nsdl.com or contact NSDL at the following Toll Free no. 1800222990.
- E-voting by electronic mode shall not be allowed beyond 5.00 p.m. on 29th September, 2021.
- The members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend the AGM thru VC/OAVM but shall not be entitled to cast their vote again.
- Members of the Company holding shares either in physical form or in dematerialised form as on the cut-off date of 23rd September, 2021 only shall be entitled to avail the facility of remote e-voting as well as the Annual General Meeting. The voting rights of the members shall be in proportion to their shares of the paid-up equity share capital of the Company.
- The Company is also providing remote e-voting facility to its members in respect of the business to be transacted during the 37th AGM. Members may follow the same procedure for e-voting during the 37th AGM as mentioned above for remote e-voting. Only those Members, who will present in the 37th AGM through VC/OAVM Facility and have not cast their vote on the Resolutions through remote e-voting shall be eligible to vote through e-voting system in the 37th AGM.
- The Annual Report for the financial year 2020-21 of which the Notice of the 37th AGM is a part is also available on the Company's website www.rcvp.in and on the website of National Securities Depository Services Ltd.(NSDL) at www.evoting.nsdl.com.
- The Shareholders may contact the undersigned for any grievances connected with electronic voting.
 Mrs. Deepthi Parekh, Company Secretary
 Royal Cushion Vinyl Products Limited
 "Shlok" 60 - CD, Govt. Industrial Estate, Charkop, Kandivali (W), Mumbai - 400 067; Email: legalho83@gmail.com
 Tel no:022-28603514.

By order of the Board of Directors
 for Royal Cushion Vinyl Products Limited
 Sd/-
 Deepthi Parekh
 Company Secretary

Dated: September 07, 2021
 Place: Mumbai

MUTUALFUNDS
 Sahi Hai

uti
 UTI Mutual Fund

Haq, ek behtar zindagi ka.

Notice - Income Distribution Cum Capital Withdrawal

Sr. No.	Scheme Name	Option/Plan	NAV as on 06-09-2021 (per unit)	
			Proposed Gross IDCW per Unit (₹)	Nav per Unit (₹)
1	UTI - Fixed Income Interval Fund - Quarterly Interval Plan I	Retail Direct Plan - IDCW Option	0.0765	10.0890
2	UTI - Fixed Income Interval Fund - Quarterly Interval Plan I	Retail Existing Plan - IDCW Option	0.0715	10.0817
3	UTI - Fixed Income Interval Fund - Annual Interval Plan I	Retail Existing Plan - IDCW Option	0.0746	10.0856
4	UTI - Fixed Income Interval Fund - Annual Interval Plan II	Retail Direct Plan - IDCW Option	0.0774	10.0908
5	UTI - Fixed Income Interval Fund - Annual Interval Plan II	Retail Existing Plan - IDCW Option	0.0749	10.0856
6	UTI - Fixed Income Interval Fund - Quarterly Interval Plan III	Retail Direct Plan - IDCW Option	0.0798	10.0912
7	UTI - Fixed Income Interval Fund - Quarterly Interval Plan III	Retail Existing Plan - IDCW Option	0.0743	10.0849
8	UTI - Fixed Income Interval Fund - Annual Interval Plan III	Retail Direct Plan - IDCW Option	0.0722	10.0914
9	UTI - Fixed Income Interval Fund - Annual Interval Plan III	Retail Existing Plan - IDCW Option	0.0692	10.0815
10	UTI - Fixed Income Interval Fund - Annual Interval Plan IV	Retail Direct Plan - IDCW Option	0.0769	10.0879
11	UTI - Fixed Income Interval Fund - Annual Interval Plan IV	Retail Existing Plan - IDCW Option	0.0744	10.0882
12	UTI - Fixed Income Interval Fund - Half Yearly Plan I	Retail Direct Plan - IDCW Option	0.0696	10.0791
13	UTI - Fixed Income Interval Fund - Half Yearly Plan I	Retail Existing Plan - IDCW Option	0.0540	10.0616
14	UTI - Fixed Income Interval Fund - Half Yearly Plan II	Retail Direct Plan - IDCW Option	0.0918	10.2416
15	UTI - Fixed Income Interval Fund - Half Yearly Plan II	Retail Existing Plan - IDCW Option	0.0605	10.0691
16	UTI - Fixed Term Income Fund - Sr-2 Quarterly Interval Plan IV	Retail Direct Plan - IDCW Option	0.0709	10.0811
17	UTI - Fixed Term Income Fund - Sr-2 Quarterly Interval Plan IV	Retail Existing Plan - IDCW Option	0.0660	10.0754
18	UTI - Fixed Term Income Fund - Sr-2 Quarterly Interval Plan V	Retail Direct Plan - IDCW Option	0.0830	10.0949
19	UTI - Fixed Term Income Fund - Sr-2 Quarterly Interval Plan V	Retail Existing Plan - IDCW Option	0.0714	10.0818
20	UTI - Fixed Term Income Fund - Sr-2 Quarterly Interval Plan VI	Retail Direct Plan - IDCW Option	0.0773	10.0883
21	UTI - Fixed Term Income Fund - Sr-2 Quarterly Interval Plan VI	Retail Existing Plan - IDCW Option	0.0724	10.0826
22	UTI - Fixed Term Income Fund - Sr-2 Quarterly Interval Plan VII	Retail Direct Plan - IDCW Option	0.0594	10.0678
23	UTI - Fixed Term Income Fund - Sr-2 Quarterly Interval Plan VII	Retail Existing Plan - IDCW Option	0.0545	10.0623
24	UTI - Fixed Term Income Fund Series XXX-IV (1125 Days)	Direct Plan - Quarterly Payout of IDCW option	0.1612	10.2284
25	UTI - Fixed Term Income Fund Series XXX-IV (1125 Days)	Regular Plan - Quarterly Payout of IDCW option	0.1529	10.2191
26	UTI - Fixed Term Income Fund Series XXX-V (1135 Days)	Regular Plan - Quarterly Payout of IDCW option	0.1598	10.3022
27	UTI - Fixed Term Income Fund Series XXX-VI (1107 Days)	Direct Plan - Quarterly Payout of IDCW option	0.1052	10.1341
28	UTI - Fixed Term Income Fund Series XXX-VI (1107 Days)	Regular Plan - Quarterly Payout of IDCW option	0.1096	10.1243
29	UTI - Fixed Term Income Fund Series XXX-IV (1266 Days)	Direct Plan - Quarterly Payout of IDCW option	0.1884	10.2145
30	UTI - Fixed Term Income Fund Series XXX-IX (1266 Days)	Regular Plan - Quarterly Payout of IDCW option	0.1796	10.2044
31	UTI - Fixed Term Income Fund Series XXX-X (1267 Days)	Direct Plan - Quarterly Payout of IDCW option	0.2009	10.4641
32	UTI - Fixed Term Income Fund Series XXX-X (1267 Days)	Regular Plan - Quarterly Payout of IDCW option	0.1943	10.4565
33	UTI - Fixed Term Income Fund Series XXX-IX (1246 Days)	Direct Plan - Quarterly Payout of IDCW option	0.2079	10.3344
34	UTI - Fixed Term Income Fund Series XXX-XI (1246 Days)	Regular Plan - Quarterly Payout of IDCW option	0.1974	10.3434
35	UTI - Fixed Term Income Fund Series XXX-XII (1254 Days)	Regular Plan - Quarterly Payout of IDCW option	0.1964	10.4303
36	UTI - Fixed Term Income Fund Series XXX-XIII (1224 Days)	Regular Plan - Quarterly Payout of IDCW option	0.1982	10.3198
37	UTI - Fixed Term Income Fund Series XXX-XIV (1209 Days)	Direct Plan - Quarterly Payout of IDCW option	0.2099	10.3636
38	UTI - Fixed Term Income Fund Series XXX-XIV (1209 Days)	Regular Plan - Quarterly Payout of IDCW option	0.1957	10.4173
39	UTI - Fixed Term Income Fund Series XXX-XV (1223 Days)	Regular Plan - Quarterly Payout of IDCW option	0.1969	10.3874
40	UTI - Fixed Term Income Fund Series XXX-I (1209 Days)	Direct Plan - Quarterly Payout of IDCW option	0.2045	10.3598
41	UTI - Fixed Term Income Fund Series XXX-II (1209 Days)	Regular Plan - Quarterly Payout of IDCW option	0.1950	10.3492
42	UTI - Fixed Term Income Fund Series XXX-II (1222 Days)	Direct Plan - Quarterly Payout of IDCW option	0.2108	10.4286
43	UTI - Fixed Term Income Fund Series XXX-II (1222 Days)	Regular Plan - Quarterly Payout of IDCW option	0.1991	10.4154
44	UTI - Fixed Term Income Fund Series XXX-III (1174 Days)	Direct Plan - Quarterly Payout of IDCW option	0.1988	10.3661
45	UTI - Fixed Term Income Fund Series XXX-III (1174 Days)	Regular Plan - Quarterly Payout of IDCW option	0.1883	10.4081
46	UTI - Fixed Term Income Fund Series XXX-IV (1204 Days)	Direct Plan - Quarterly Payout of IDCW option	0.2046	10.5015
47	UTI - Fixed Term Income Fund Series XXX-IV (1204 Days)	Regular Plan - Quarterly Payout of IDCW option	0.1984	10.4568
48	UTI - Fixed Term Income Fund Series XXX-V (1174 Days)	Direct Plan - Quarterly Payout of IDCW option	0.2052	10.5415
49	UTI - Fixed Term Income Fund Series XXX-V (1174 Days)	Regular Plan - Quarterly Payout of IDCW option	0.1955	10.5305
50	UTI - Fixed Term Income Fund Series XXX-VI (1167 Days)	Direct Plan - Quarterly Payout of IDCW option	0.2008	10.3530
51	UTI - Fixed Term Income Fund Series XXX-VI (1167 Days)	Regular Plan - Quarterly Payout of IDCW option	0.1935	10.3448
52	UTI - Fixed Term Income Fund Series XXX-VII (1155 Days)	Direct Plan - Quarterly Payout of IDCW option	0.1890	10.4945
53	UTI - Fixed Term Income Fund Series XXX-VII (1155 Days)	Regular Plan - Quarterly Payout of IDCW option	0.1800	10.4843
54	UTI - Fixed Term Income Fund Series XXX-VIII (1153 Days)	Direct Plan - Quarterly Payout of IDCW option	0.1949	10.3662
55	UTI - Fixed Term Income Fund Series XXX-VIII (1153 Days)	Regular Plan - Quarterly Payout of IDCW option	0.1877	10.3583
56	UTI - Fixed Term Income Fund Series XXX-IX (1168 Days)	Direct Plan - Quarterly Payout of IDCW option		

સરકારી શાળાના શિક્ષકોની ૮ કલાકની ફરજ બજાવવી પડશે : શિક્ષણમંત્રી ચુડાસમા

પ્રતિનિધિ) અમદાવાદ, તા.૭ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પણ શિક્ષકોને શાળામાં આઠ કલાક ફરજ બજાવવાનો નિયમ કરવામાં આવ્યો છે. તેથી રાજ્યના શિક્ષક સંઘ દ્વારા રાજ્ય સરકાર સામે શાળામાં શિક્ષકોનો સમય પહેલાની જેમ યથાવત કરવા માટે રજૂઆત કરી હતી. પણ રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની માગણીને ઠગાવવામાં આવી છે. જેથી શાળામાં શિક્ષકોને ૮ કલાક ફરજ બજાવવી પડશે. શિક્ષકો પણ સરકારી કર્મચારી છે અને બીજા સરકારી કર્મચારીઓ ૮ કલાક નોકરી કરે છે, તેવું નિવેદન રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આપવામાં આવ્યું છે.

રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સરકારના બધા કર્મચારીઓ ૮ કલાક કામ કરતા હોય ત્યારે શિક્ષકો પણ રાજ્ય સરકારના

કર્મચારી જ છે. એટલે અન્ય વિભાગની જેમ શિક્ષકોએ પણ શાળામાં ૮ કલાક આવવું જોઈએ. સાથે જ તેમને ધોરણ ૧ થી પની શાળા શરૂ કરવા બાબતે જણાવ્યું હતું કે, અમે વિદ્યાર્થી અને તેના સ્વાસ્થ્યના હિતમાં નિર્ણય કરીએ છીએ. પહેલા કોલેજ, પછી ૯, ૧૦, ૧૧, ૧૨ પછી ૨ તારીખથી ૬ થી ૮ અને હવેનો નિર્ણય નાના બાળકોને સ્પર્શે છે. એટલે તેમનું સ્વાસ્થ્ય બચાવવાઈ રહે તે પ્રમાણે યોગ્ય સમય આ બાબતે નિર્ણય કરીશું.

મહત્વનું છે કે, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા થોડા દિવસ પહેલા જ નિર્ણય કરવામાં આવ્યો હતો કે, શિક્ષકોએ શાળામાં ૮ કલાકની જગ્યા પર ૮ કલાકનો સમય આપવો પડશે. સરકારના આ નિર્ણય અનુસાર શિક્ષકોને શાળામાં સવારે ૧૦ થી સાંજને ૬ વાગ્યા સુધી હાજર રહેવું પડશે. શિક્ષણ વિભાગ દ્વારા રાઈટ ટુ એન્ફ્યુશન એક્ટની બેલાઈ અનુસાર

શિક્ષકોને ૬ કલાકની જગ્યા પર ૮ કલાક હાજર રહેવાની બેલાઈ કરવામાં આવી હતી. આરટીઈ એક્ટની બેલાઈ અનુસાર રાજ્યના શિક્ષકોએ હવે એક અઠવાડિયામાં શાળામાં ૪૫ કલાક હાજરી આપવી પડશે.

સોમથી શુક્રવાર સુધી શાળામાં શિક્ષકોએ ૮ કલાકની કામગીરી કરવાની રહેશે. શનિવારના રોજ શિક્ષકોએ ૫ કલાકની કામગીરી કરવાની રહેશે. પણ રાજ્યના શિક્ષકો આ નિર્ણયને માનવા તૈયાર ન હોય તેવું લાગી રહ્યું છે. અગાઉ બ્યારે રાજ્ય સરકાર દ્વારા શિક્ષક સક્ષતા સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું તે સમયે પણ રાજ્યના મોટાભાગના શિક્ષકોએ આ સર્વેક્ષણનો બહિષ્કાર કર્યો હતો. ત્યારે કેટલાક શિક્ષકોના મત અનુસાર શિક્ષકોની સંખ્યા ઘટાડવા માટે શિક્ષણ વિભાગે શિક્ષકોને ૮ કલાકની નોકરી કરવાનો આદેશ આપીને નામે કર્યો હોઈ શકે છે.

હવે ગુજરાતમાં ધો. ૧ થી પના ઓફલાઇન વર્ગો શરૂ કરવાની તૈયારી, શિક્ષણપ્રધાને આખો સંકેત

(પ્રતિનિધિ) અમદાવાદ, તા.૭ રાજ્યમાં કોરોનાના કેસ ઘટી ગયા છે. ફરીથી ડિજિટીલ પૂર્વવત થઈ રહી છે. ત્યારે હવે ધોરણ ૧ થી પના ઓફલાઇન વર્ગો શરૂ કરવા પર રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે સંકેત આપ્યો છે. કેવડીયા ખાતે શુરુપાણેશ્વર મહાદેવની પૂજા દરમિયાનમાં જણાવ્યું કે, 'કોર કમિટી અને આરોગ્ય વિભાગની બેઠક તેમજ શિક્ષણવિદોની સલાહ બાદ અમે યોગ્ય નિર્ણય કરીશું.'

પહેલાં કોલેજ બાદમાં ધોરણ ૧૦ થી ૧૨ ના વર્ગો શરૂ કરવામાં આવ્યાં હતાં તેમજ ગત અઠવાડિયામાં ધોરણ ૬, ૭ અને ૮ ના વર્ગો ખોલવામાં પણ સફળ રહ્યાં હતાં. વાલીઓ બાળકોને સ્કૂલે મોકલી રહ્યાં છે તો બીજી તરફ શિક્ષકો પણ ઉત્સાહથી ભાગી પડ્યાં છે. ત્યારે આગામી તબક્કામાં કોર કમિટીમાં ધોરણ ૧ થી પના વર્ગો શરૂ કરવા અંગે વિચાર કરીશું. એ માટે આરોગ્ય અને શિક્ષણવિદોની સલાહ પણ લઈશું.'

અગાઉ ધોરણ ૧ થી ૫ થી ૮ ના વર્ગો તો રજા સપ્ટેમ્બરથી શરૂ કરી દેવામાં આવ્યાં છે. જેમાં ૫૦ ટકાની સંખ્યા સાથે વર્ગો શરૂ કરી દેવાની મંજૂરી આપી દેવામાં આવી છે. તદુપરાંત ધોરણ ૬ થી ૧૨ ના વર્ગો પણ શરૂ છે. બે કે, શાળામાં

પહેલાં કોલેજ બાદમાં ધોરણ ૧૦ થી ૧૨ ના વર્ગો શરૂ કરવામાં આવ્યાં હતાં તેમજ ગત અઠવાડિયામાં ધોરણ ૬, ૭ અને ૮ ના વર્ગો ખોલવામાં પણ સફળ રહ્યાં હતાં. વાલીઓ બાળકોને સ્કૂલે મોકલી રહ્યાં છે તો બીજી તરફ શિક્ષકો પણ ઉત્સાહથી ભાગી પડ્યાં છે. ત્યારે આગામી તબક્કામાં કોર કમિટીમાં ધોરણ ૧ થી પના વર્ગો શરૂ કરવા અંગે વિચાર કરીશું. એ માટે આરોગ્ય અને શિક્ષણવિદોની સલાહ પણ લઈશું.'

અગાઉ ધોરણ ૧ થી ૫ થી ૮ ના વર્ગો તો રજા સપ્ટેમ્બરથી શરૂ કરી દેવામાં આવ્યાં છે. જેમાં ૫૦ ટકાની સંખ્યા સાથે વર્ગો શરૂ કરી દેવાની મંજૂરી આપી દેવામાં આવી છે. તદુપરાંત ધોરણ ૬ થી ૧૨ ના વર્ગો પણ શરૂ છે. બે કે, શાળામાં

Shaily Engineering Plastics Limited
 Engineering Plastics Ltd
 CIN : L51900GJ1980PLC065554
 Regd. Office : Survey # 364/366, Post : Rania - 391 780, Taluka : Savli, Dist. Vadodara.
 Phone No. : 02667 - 244307/ 361 | Fax No. : 02667-244372
 E-mail : investors@shaily.com | Visit us : www.shaily.com

Corrigendum to Notice of the 41st Annual General Meeting of the Company

Notice is hereby given that Shaily Engineering Plastics Limited ("the Company") had issued Notice dated 17th August, 2021 ("AGM Notice") for convening the 41st Annual General Meeting ("AGM") of the shareholders, scheduled to be held on Tuesday, 14th September, 2021, through Video Conferencing ("VC") or other Audio-Visual Means ("OAVM"). The AGM Notice has already been circulated to all the Shareholders of the Company in due compliance with the provisions of the Companies Act, 2013 and read with the Rules made thereunder.

This corrigendum should be read in conjunction with the AGM Notice, details are as follows :-

- In Item No. 7, for Preferential issue of shares of the Company, under the table appearing at Page No. 5 of the AGM Notice, whereunder the list of allottees have been mentioned, for the particulars of Investor - Light House India Fund III, Limited, the category of the Investor will be read as "**Foreign Bodies Corporate (Non-Promoter)**" instead of "Foreign Portfolio Investor (Non-Promoter)".
- Accordingly, in Explanatory Statement for Item No. 7 of the AGM Notice for Preferential issue of shares of the Company, at point no. (C) and (J) in the table containing the list of allottees at Page No. 14 and 15 of the AGM Notice respectively, for particulars of Investor - Light House India Fund III, Limited, the category of the Investor will be read as "**Foreign Bodies Corporate (Non-Promoter)**" instead of "Foreign Portfolio Investor (Non-Promoter)".
- In the Explanatory Statement for Item No. 7, at point no. (K) under the Shareholding Pattern of the Company before and after the Preferential Issue of Equity shares, shareholding details of Light House India Fund III, Limited will accordingly be shifted from the category of - "Foreign Portfolio Investors" to "**Bodies Corporate**" under the heading of Public Shareholder.

Other contents of the AGM Notice remain unchanged. This Corrigendum shall form an integral part of the AGM Notice circulated to the shareholders of the Company. Accordingly, all concerned shareholders, Stock Exchange, Depositories, Registrar and Share Transfer Agent, agencies appointed for e-voting, other Authorities, regulators and all other concerned persons are requested to take note of the above changes.

This Corrigendum shall also be available at the website of the Company at www.shaily.com at weblink <https://www.shaily.com/investors/annual-report> and on the website of BSE Limited at www.bseindia.com.

For Shaily Engineering Plastics Limited
 Sd/-
 Mahendra Sanghvi
 Executive Chairman

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી આગામી બે દિવસ ભારે વરસાદ પડશે અમદાવાદ શહેરમાં લાંબા વિરામ બાદ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

(પ્રતિનિધિ)અમદાવાદ,તા.૭ ગુજરાતમાં આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્ભતા રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં ૮ અને ૯ સપ્ટેમ્બરે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે જ્યારે દરિયા કિનારાના બિજામાં પાંચ દિવસ માછીમારોને દરિયા ને ખેડવા ચેતવણી આપવામાં આવી છે.

ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં પણ લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું હતું. જેમાં શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો સાથે આજે મેઘવર્ષાનું આગમન થયું હતું. શહેરના વસ્ત્રાલ, ઓટવા, સીટીએમ, રવારી કોલોની ઉપરાંત એસ.જી.હાઇવે, બોપલ, ઘુમા, સેટેલાઈટ, વેજલપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બ્યારે શહેરમાં મેઘવર્ષાનું આગમન થતા ભારે બકારા થી શહેરીજનોને રાહત મળી છે.

અંબાજીમાં વરસાદે ધમાકેદાર બેઠેંગ કરી હોવાથી અંબાજીના માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ભકતોની અવરજવર વચ્ચે અત્યાંક વરસાદ શરૂ થતા શ્રદ્ધાળુઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મહાભેળો શરૂ થતા પહેલા જ મોટી સંખ્યામાં લોકો અંબાજી તરફ પગપાળા જઈ રહ્યાં છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલે ૮ સપ્ટેમ્બરે વસારી- વસારા- ખેડા- આણંદ- દાહોદ- વડોદરા- નર્મદા- ભરૂચ- સુરત- ડાંગ- તાપી- અમરેલી- ભાવનગર- ગીર સોમનાથ-દીવ, ૯ સપ્ટેમ્બરે જુનાગઢ-ભાવનગર- અમરેલી-ગીર સોમનાથ- રાજકોટ- વડોદરા- ભરૂચ- સુરત- નવસારી- ગાંધીનગર- અરવલ્લી- ખેડા- અમદાવાદ- આણંદ- પંચમહાલ- દાહોદ, ૧૦ સપ્ટેમ્બરે ગીર સોમનાથ- અમદાવાદ- આણંદ- પંચમહાલ- દાહોદ-છોટા- ઉત્તર પુર- નર્મદા- સુરેન્દ્રનગર- જુનાગઢ- અમરેલી- બોટાદ- દીવ- અરવલ્લી- મહીસાગર- નવસારી-વલસાડમાં, બ્યારે ૧૧ સપ્ટેમ્બરે ગાંધીનગર- ખેડા- અમદાવાદ-સુરત-નવસારી- ગીર સોમનાથ-બોટાદ-દીવમાં ભારે વરસાદ પડી શકે છે.

બીજી તરફ, રાજ્યના અત્યાર સુધી ૫૦ ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેના લીધે ડેમો અને નદીઓમાં નવા નીર પણ આવ્યા છે. તેમજ વરસાદની ઘટ પણ ઘટી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં કરેલી આગાહીથી ખેડૂતો સહિત સામાન્ય લોકોને પણ મોટી રાહત મળી છે. દરમિયાન દક્ષિણ ગુજરાતમાં પંચમહાલ જિલ્લો, સુરત, મહીસાગર નવસારી પંચકમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. પંચમહાલના મોરવા હડક તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ બન્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ હતી. ભારે વરસાદથી રોડ રસ્તા પર પાણી વહેતા થયા હતા. સુરતમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે ફરી મેઘવર્ષાની પધરામણી થઈ હતી. સુરતના અઠવાલાઈન્સ, સેક્ટ, અડાજણ, ઉધના તેમજ વરાછા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો. લાંબા વિરામબાદ જિલ્લામાં વીજળીના કડકા સાથે વરસાદ ખાલ્યો હતો. સંતરમપુર, કડાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ બન્યો હતો. વરસાદી વાતાવરણથી મકાઈ,સુંદીયું સહિત પાકમાં મોટી રાહત મળી હતી. મહીસાગર જિલ્લામાં ૧લાખથી પણ ઉપરાંત હેક્ટરમાં વાવેતરમાં રાહત થઈ હતી. નવસારીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી રોડ રસ્તા અને સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા હતા.કાળા ડિબાંગ વાદળો સાથે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.વરસાદી માહોલથી ડાંગર, શેરી અને શાકભાજી સહિતના પાકોને રાહત મળી હતી.

બીજી તરફ, રાજ્યના અત્યાર સુધી ૫૦ ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેના લીધે ડેમો અને નદીઓમાં નવા નીર પણ આવ્યા છે. તેમજ વરસાદની ઘટ પણ ઘટી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં કરેલી આગાહીથી ખેડૂતો સહિત સામાન્ય લોકોને પણ મોટી રાહત મળી છે. દરમિયાન દક્ષિણ ગુજરાતમાં પંચમહાલ જિલ્લો, સુરત, મહીસાગર નવસારી પંચકમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. પંચમહાલના મોરવા હડક તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ બન્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ હતી. ભારે વરસાદથી રોડ રસ્તા પર પાણી વહેતા થયા હતા. સુરતમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે ફરી મેઘવર્ષાની પધરામણી થઈ હતી. સુરતના અઠવાલાઈન્સ, સેક્ટ, અડાજણ, ઉધના તેમજ વરાછા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો. લાંબા વિરામબાદ જિલ્લામાં વીજળીના કડકા સાથે વરસાદ ખાલ્યો હતો. સંતરમપુર, કડાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ બન્યો હતો. વરસાદી વાતાવરણથી મકાઈ,સુંદીયું સહિત પાકમાં મોટી રાહત મળી હતી. મહીસાગર જિલ્લામાં ૧લાખથી પણ ઉપરાંત હેક્ટરમાં વાવેતરમાં રાહત થઈ હતી. નવસારીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી રોડ રસ્તા અને સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા હતા.કાળા ડિબાંગ વાદળો સાથે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.વરસાદી માહોલથી ડાંગર, શેરી અને શાકભાજી સહિતના પાકોને રાહત મળી હતી.

ગુજરાતના બધાં એક તરફ કોરોના સંક્રમણના આંકડા સતત ઘટી રહ્યા છે તો બીજી બાજુ સરકારે કોરોના રસીકરણની ઝડપ પણ વધારી દીધી છે. જેને પગલે ગુજરાત કોરોના વેકસિનેશનમાં વધુને વધુ મોટી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે. ગુજરાતમાં કરોડો લોકોએ કોરોના રસીકરણનો લાભ લીધો છે. ઉપરાંત નીતિન પટેલે નાણાકો અમે તબીબોને શુભેચ્છા પાઠવી હતી અને વેકસિન મેળવનાર નાગરિકો અને કોરોના વોરિયર્સ ડોક્ટર નર્સીસ અને અન્ય પેરામીડીકલ સ્ટાફને અભિનંદન આપ્યા હતા.

ગુજરાતના બધાં એક તરફ કોરોના સંક્રમણના આંકડા સતત ઘટી રહ્યા છે તો બીજી બાજુ સરકારે કોરોના રસીકરણની ઝડપ પણ વધારી દીધી છે. જેને પગલે ગુજરાત કોરોના વેકસિનેશનમાં વધુને વધુ મોટી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે. ગુજરાતમાં કરોડો લોકોએ કોરોના રસીકરણનો લાભ લીધો છે. ઉપરાંત નીતિન પટેલે નાણાકો અમે તબીબોને શુભેચ્છા પાઠવી હતી અને વેકસિન મેળવનાર નાગરિકો અને કોરોના વોરિયર્સ ડોક્ટર નર્સીસ અને અન્ય પેરામીડીકલ સ્ટાફને અભિનંદન આપ્યા હતા.

ગુજરાતના બધાં એક તરફ કોરોના સંક્રમણના આંકડા સતત ઘટી રહ્યા છે તો બીજી બાજુ સરકારે કોરોના રસીકરણની ઝડપ પણ વધારી દીધી છે. જેને પગલે ગુજરાત કોરોના વેકસિનેશનમાં વધુને વધુ મોટી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે. ગુજરાતમાં કરોડો લોકોએ કોરોના રસીકરણનો લાભ લીધો છે. ઉપરાંત નીતિન પટેલે નાણાકો અમે તબીબોને શુભેચ્છા પાઠવી હતી અને વેકસિન મેળવનાર નાગરિકો અને કોરોના વોરિયર્સ ડોક્ટર નર્સીસ અને અન્ય પેરામીડીકલ સ્ટાફને અભિનંદન આપ્યા હતા.

મુખ્ય પ્રધાન અને નીતિ આયોગના ચેરમેન વચ્ચે ફ્લેગશિપ પ્રોગ્રામ- વિકાસ કાર્યોની સિદ્ધિઓ અને કોવિડ અંગેની ચર્ચા

(પ્રતિનિધિ)અમદાવાદ, તા. ૭ નીતિ આયોગના વાઈસ ચેરમેન રાજવકુમારે ગુજરાતની પોતાની મુલાકાત દરમિયાન મંગળવારે સવારે મુખ્યપ્રધાન વિજયભાઈ ડ્રાણી સાથે નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ તેમજ વરિષ્ઠ સચિવો સાથે ગાંધીનગરમાં મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. મુખ્યપ્રધાન વિજય ડ્રાણીએ આ બેઠકમાં નીતિ આયોગના વાઈસ ચેરમેનને રાજ્ય સરકારના ફ્લેગશિપ પ્રોગ્રામ, મુખ્યપ્રધાન ગ્રામ સડક માણેજના પુરાણભાઈ પંચાભાઈ મકવાલા ગુમ થયા વડોદરા તા.૭ વડોદરા શહેરના માણેજ વિસ્તારમાં મકાન નં. ૩૬ વિઠ્ઠલ નગરમાં રહેતા પુરાણભાઈ પંચાભાઈ મકવાલા ઉંમર વર્ષ ૬૩ તા. ૨૫.૦૮.૨૦૨૧ ના રોજ પોતાના ઘરેથી સવારે કોઈને કશું બાજુ કર્યા વગર પીધેલ હાલતમાં જતા રહ્યા છે. ત્યાર બાદ અહીંન સુધી પરત મળી આવેલ નથી.

Samrat Pharmachem Limited
 Regd. Office & Factory Plot No. A/2 3445, GIDC, Phase 4, Opp. PCI, Ankleswar - 393 002, Gujarat, India. Tel: (02646) 220774 Fax : (02646) 251291
 Corporate Office 701/702 Business Square, M. A. Road, Andheri (West), Mumbai - 400 058, India. Tel: (91-22) 26701050/1/2 Fax : (91-22) 26701053
 Web : www.samratpharmachem.com Email : contact@samratpharmachem.in CIN:L24230GJ1980PLC017820

Samrat Pharmachem Limited
 Regd. Office & Factory Plot No. A/2 3445, GIDC, Phase 4, Opp. PCI, Ankleswar - 393 002, Gujarat, India. Tel: (02646) 220774 Fax : (02646) 251291
 Corporate Office 701/702 Business Square, M. A. Road, Andheri (West), Mumbai - 400 058, India. Tel: (91-22) 26701050/1/2 Fax : (91-22) 26701053
 Web : www.samratpharmachem.com Email : contact@samratpharmachem.in CIN:L24230GJ1980PLC017820

NOTICE OF 29th ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE AND REMOTE E-VOTING INFORMATION

Notice is hereby given that the Twenty-Ninth Annual General Meeting of the Members of the Company will be held on Thursday, 30th September, 2021 at 1:00 p.m. through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM"), to transact the business, as set out in the Notice of the AGM which is being circulated for convening the AGM.

In view of the continuing COVID-19 pandemic, the Ministry of Corporate Affairs ("MCA") has vide its circular no. 20/2020 dated May 5, 2020 read with 14/2020, 17/2020 and 02/2021 dated April 8, 2020, April 13, 2020 and January 13, 2021 respectively (collectively referred to as "MCA Circulars") permitted the holding of the Annual General Meeting ("AGM") through VC / OAVM, without the physical presence of the Members at a common venue. In compliance with the MCA Circulars and the relevant provisions of the Companies Act, 2013 and SEBI (Listing Obligations and Disclosure Requirements), Regulations, 2015, the AGM of the members of the Company will be held through VC / OAVM.

In terms of MCA Circulars and SEBI Circular, the Notice of 29th AGM and the Annual Report for the financial year 2020-21 has been sent to those Members whose email addresses are registered with the Company/ Depository Participants. The requirements of sending physical copy of the Notice and 29th AGM and Annual Report to the Members have been dispensed with under MCA Circular and SEBI Circular.

The Register of Members and the Share Transfer books of the Company will remain closed from Thursday, September 23, 2021 to Thursday, September 30, 2021 (both days inclusive).

Members holding shares either in physical form or in dematerialized form, as on the cut-off date of September 23, 2021 may cast their vote electronically on the Ordinary Business, as set out in the Notice of 29th AGM through electronic voting system ("remote e-voting") of National Securities Depository Limited ("NSDL").

All the members are informed that:

- The Ordinary Business, as set out in the Notice of the 29th AGM, will be transacted through voting by electronic means;
- the remote e-voting shall commence on Monday, September 27, 2021 at 9:00 a.m. IST and end on Wednesday, September 29, 2021 at 5:00 p.m. IST;
- the cut-off date for determining the eligibility to vote through remote e-voting or through the e-voting system during the 29th AGM is Thursday, September 23, 2021;
- any person who acquires shares of the Company and becomes a member of the Company after sending Notice of the 29th AGM by email and holding shares as on the cut-off date i.e. September 23, 2021, may obtain the login ID and password by sending a request at evoting@nsdl.co.in or contact@samratpharmachem.in. However, if a person is already registered with NSDL for remote e-voting then existing user ID and password can be used for casting vote;
- The remote e-voting module shall be disabled by NSDL after the aforesaid date and time for voting
- Members who have voted through Remote e-Voting will be eligible to attend the AGM. However, they will not be eligible to vote at the AGM.
- The members participating in the 29th AGM and who had not cast their vote by remote e-voting, shall be entitled to cast their vote through e-voting system during the 29th AGM
- The Notice of 29th AGM and the Annual Report are available on the website of the Company at www.samratpharmachem.com. The Notice can also be accessed from the website of the stock exchange i.e. BSE Limited at www.bseindia.com and on the website of NSDL i.e. www.evoting.nsdl.com
- In case of any queries you may refer the Frequently Asked Questions (FAQs) for shareholders and e-voting user manual for shareholders available at the download section of www.evoting.nsdl.com or call on toll free no. : 1800-222-9990 or send a request to Mr. Nipul Shah at evoting@nsdl.co.in
- Members holding shares in physical form, whose email addresses are not registered with the Company, may register their email address by sending Folio No., Name of the shareholder, scanned copy of the share certificate (front and back), PAN (Self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) to contact@samratpharmachem.in. Members holding shares in electronic form shall update such details with their respective Depository Participant ("DP")

For Samrat Pharmachem Limited
 Nishant Kankaria
 Company Secretary & Compliance Officer
 Place : Mumbai Date : September 6, 2021

ગુજરાત ફ્લોરોએકેમિકલ્સ લિમિટેડ
 CIN: L24304GJ2018PLC105479
 રજીસ્ટર્ડ ઓફિસ : સર્વે નં. ૧૭/૩, ૨૬ અને ૨૭, ગામ : રાજાજીનગર - ૩૮૯ ૩૮૦ તાલુકો : ઘોઘંબા, જિલ્લો : પંચમહાલ, ગુજરાત.
 ટેલિફોન : (૯૧ ૨૬૭૮) ૨૪૨૭૨૦ ફેક્સ : (૯૧ ૨૬૭૮) ૨૪૭૨૨૦
 ઇમેઇલ : bdvdesai@gfl.co.in વેબસાઇટ : www.gfl.co.in

વીડિયો કોન્ફરન્સિંગ / અન્ય ઓડિયો વિડિયો અથવા મારફેટ યોજનાર ૩૭ વાર્ષિક સામાન્ય સભા ("ઓજીએમ") સંબંધિત માહિતી

આથી નોટિસ આપવામાં આવે છે કે ગુજરાત ફ્લોરોએકેમિકલ્સ લિમિટેડ ("કંપની") ના સભ્યોની ૩૭ એજન્ટની તૈયારી નોટિસમાં નિર્ધારિત વ્યવસ્થાના અવગણને વચૂકાવે, ૩૦મી સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ સવારે ૧૧:૩૦ વાને વીડિયો કોન્ફરન્સિંગ (વીડી) / અન્ય ઓડિયો વિડિયો અથવા મારફેટ યોજનાર ("ઓજીએમ") મારફેટ યોજનારમાં આનાથી.

નોટિસ-૧૯ ને કારણે ઘણા મહામારી વધતી જતીને કારણે, કોરોનેા બાબતોના મંગલ અંગે ("એસીએમ") એ તા. ૨૩મી સપ્ટેમ્બર, ૨૦૨૦ અને તા. ૨૩મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ના સામાન્ય પરિણામો વધાવવામાં આવી ગયા છે. પછી, ૨૦૨૦ ના સામાન્ય પરિણામો અંગે સિદ્ધિઓ અને એક્સપ્લેન્ટરી નોટિસ આપવામાં આવી છે. ૧૩મી, ૨૦૨૦ અને તા. ૧૩મી જાન્યુઆરી, ૨૦૨૧ ના પરિણામો ("સેબી પરિણામ") મારફેટ એક કમ્પ્લેક્સ રીપોર્ટ સભ્યોની નોટિસ આપવામાં આવી છે. ૨૦૨૧ ના એસીએમ મારફેટ ઓજીએમ આયોજન કરવાની મંજૂરી આપવામાં આવી છે. તા. ૧૩મી જાન્યુઆરી, ૨૦૨૧ ના એસીએમ પરિણામો જાહેર કરવામાં આવી છે. પછી, ૨૦૨૦ ના પરિણામો આપવામાં આવેલ જુલિયન અનુસાર વીડી/ઓએવીએમ માધ્યમ મારફેટ ઓજીએમ આયોજન કરવામાં આવી છે. ૨૦૨૧ ના રોજ કે તેના પહેલાં વીડી/ઓએવીએમ મારફેટ ઓજીએમ કરવામાં આવી છે. ૨૦૨૧ ના રોજ પહેલાં વીડી/ઓએવીએમ મારફેટ ઓજીએમ કરવામાં આવી છે.

એસીએમ પરિણામો અને સેબી પરિણામો અનુસાર, ઓજીએમની નોટિસ અને વર્ષ ૨૦૨૦-૨૧ માટેના વાર્ષિક અહેવાલને કંપનીના એ તમામ સભ્યોને ફક્ત ઇલેક્ટ્રોનિક માધ્યમથી મોકલવામાં આવેલ છે, જેઓ ઇમેઇલ આઈડી કંપની / ડિપોઝિટરી ભાગીદાર (સે) પાસે નોંધાયેલા છે. ૩૭ એજન્ટની નોટિસ અને વર્ષ ૨૦૨૦-૨૧ માટેના વાર્ષિક અહેવાલને કંપનીના ઓજીએમની વેબસાઇટ www.gfl.co.in પર "અન્ટરકસ્ટ રિજિસ્ટ્રેશન" વિભાગ હેઠળ અને કંપનીના જોર ચાલુ સિસ્ટમને તે રોજ બંધ કરવામાં આવેલ છે. ઓજીએમની વેબસાઇટ www.bseindia.com તથા નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયાના ટિમિડેટિંગ સિસ્ટમને www.nseindia.com તથા નેશનલ